



COVID-19 મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં લેબર ડે 2020

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 2, 2020) – આ વર્ષે, લેબર ડે સોમવાર, સપ્ટેમ્બર 7 નાં રોજ આવે છે.

અગ્નિશમન અને કટોકટી સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ નિર્ણાયક સેવાઓનું સંચાલન સમુદાયને ટેકો આપવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા (બ્રેમ્પટન બહારથી) 905.874.2000 નંબર પર ફોન કૉલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca જોઈ શકે છે અથવા ઈમેઈલ સરનામું 311@brampton.ca પર ઈમેઈલ મોકલી શકે છે. પાર્ક્સમાં સુરક્ષા ઉપાયો, માર્ક પહેરવો અને માત્ર એપોઈન્ટમેન્ટથી પસંદ કરેલી સીટીની સગવડો સુરક્ષિતપણે ફરીથી ખોલવી જવી COVID-19 ને સંબંધિત પૂછપરછો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલની કોઈપણ બાબતો માટે અમે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ. વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 જુઓ.

આતશબાજી સુરક્ષા

સીટી ઓફ બ્રેમ્પટન લેબર ડે પર કોઈ આતશબાજી પ્રદર્શન કરશે નહિ અને અંગત ધોરણે આતશબાજી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

લેબર ડે વર્ષ દરમિયાનના એ ચાર દિવસો પૈકી એક નથી જ્યારે સીટી ઓફ બ્રેમ્પટનમાં અંગત આતશબાજી કરવાની છૂટ આપવામાં આવતી હોય. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/bylaws.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ લેબર ડે પર રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે પણ કેટલાક રૂટ્સ રદ કરવામાં આવશે. કૃપા કરી મુસાફરી કરતા પહેલાં સમયપત્રકો તપાસો.

ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 7 થી સાંજે 9 વાગ્યા સુધી 905.874.2999 નંબર પર ચાલુ અને ઉપલબ્ધ છે.

એક રિમાઈન્ડર તરીકે, બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. ટ્રિનિટી કોમન ટર્મિનલ બંધ રહે છે. ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસના ક્લાકો માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી માર્ક પહેર્યો હોય તો પણ ઉતારુઓને ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું આચરણ ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને મુસાફરી કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે

રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાર્થટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માસ્ક્સ પહેરવા અનિવાર્ય બને છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

પાર્ક્સ (ઉદ્યાનો) અને રિક્રિએશન (મનોરંજન)

પસંદ કરેલી મનોરંજન સગવડો સપ્ટેમ્બર 8 નાં રોજ માત્ર આરક્ષિત એપોઈન્ટમેન્ટ્સ માટે ખુલશે, જેમાં ઈનડોર પૂલ્સ, ફિટનેસ સગવડો, અને સીમિત સામાન્ય કાર્યક્રમો સામેલ છે. લેબર 3 પર પછી શરૂ થતા બધાં કાર્યક્રમો અને સેવાઓ પર માહિતી માટે, જગ્યા કેવી રીતે આરક્ષિત કરાવવી તે સહિત, આ વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ.

કૃપા કરી નોંધી લેશો કે પાર્કમાં મફત, ડ્રોપ-ઇન ફિટનેસ વર્ગો લેબર 3 પર ચાલશે નહીં.

સંપૂર્ણ બોડી સરકિટ સાથે તંદુરસ્ત રહો, ઓરિગામી હાટ્સ બનાવવાનું શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણું બધુંનો મહાવરો કરો! રેક એટ હોમ (Rec At Home) પ્રવૃત્તિઓ જોવા અહીંથી પ્રવેશો, www.brampton.ca/recreation.

બ્રેમ્પટન લાઈબ્રેરી

બધી લાઈબ્રેરી શાખાઓ હાલમાં બંધ છે. [કુર્બસાઈડ પિકઅપ](#) ઉપલબ્ધ છે અને બધી આઠ શાખાઓમાં બાહ્ય ડ્રોપબોક્સીસ મારફતે રિટર્ન્સ 24/7 સ્વીકારવામાં આવે છે. તમને મફતમાં ઉપલબ્ધ eBooks (ઈ-બૂક્સ) અને eAudiobooks (ઈ-ઓડિયોબૂક્સ), એન્ટરટેઈનમેન્ટ સ્ટ્રીમિંગ, ઓનલાઈન શિક્ષણ અને ઘણું બધું [ડિજિટલ લાઈબ્રેરી](#)માંથી તમારા બ્રેમ્પટન લાઈબ્રેરી કાર્ડ નંબર અને PIN (પિન) વડે શોધી કાઢો. [અહીં ક્લિક કરો](#), એક ઓનલાઈન લાઈબ્રેરી કાર્ડ મેળવવા અથવા તમારા એકાઉન્ટ સંબંધિત સહાયતા માટે. બધી ઉંમરના લોકો માટેના વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સમાં સહભાગી થાવ અને સંપર્કમાં રહેવા [બ્રેમ્પટન લાઈબ્રેરીની ઈમેઈલ અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરો](#). અમારી સાથે Facebook, Twitter અને Instagram પર [@bramptonlibrary](https://www.instagram.com/bramptonlibrary) મારફતે જોડાઓ.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર લેબર 3 નિમિત્તે બંધ રહેશે.

એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રસ્તા પર રહે છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઈજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી



- ઘોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવા
- મરેલું પ્રાણી લઈ જવા

એનિમલ કંટ્રોલ આ સિવાયના સમયે, માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

-30-

મિડિયા સંપર્ક

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca